

7th Meeting of India-Mongolia Joint Committee on Cooperation December 03, 2020

ભારત મંગોલિયા સહકાર માટેની સંયુક્ત સમિતિ ની સાતમી મીટીંગ ડિસેમ્બર ૩ ૨૦૨૦

ભારત મંગોલિયા સહકાર માટેની સંયુક્ત સમિતિ ની સાતમી મીટીંગ ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ વર્ચ્યુઅલ યોજાઈ હતી. આ મીટીંગ શુ કરી તે ડોક્ટર એસ જયશંકર એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર, ભારત સરકાર અને મહામહિમ શ્રી એલ.ઓયુન-એરડીન મિનિસ્ટર એન્ડ ચીફ કેબિનેટ સેક્રેટરી ગવર્નમેન્ટ ઓફ મોંગોલિયા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી.

2. બંને મિનિસ્ટર્સ દ્વારા દ્વિપક્ષીય સહકાર ને આવરી લેતા સમગ્ર મુદ્દાઓ બાબતે સર્વગ્રાહી ચર્ચાઓ થઈ હતી. બંને મિનિસ્ટર્સ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મે-૨૦૧૫ માં મોંગોલિયાની ઐતિહાસિક રાજકીય મુલાકાત યાદ કરી હતી કે જેમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી ને વ્યૂહાત્મક ભાગીદારી સુધી આગળ લઈ જવા માં આવી હતી. બંને પક્ષોએ મોંગોલિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ખલતામાગીનબાતુંલગા ની સપ્ટેમ્બર-૨૦૧૯ માં ભારતની રાજકીય મુલાકાત ને પણ યાદ કરી હતી અને એવું નોંધ્યું હતું કે આ મુલાકાતોએ દ્વિપક્ષીય બાબતો અને વેલ્યુઝને આગળ લઈ જવામાં ઘણો બધો ફાળો આપ્યો હતો .
3. બંને મિનિસ્ટરે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે આ વર્ષમાં ભારત અને મોંગોલિયાના રાજનૈતિક સંબંધો ની સ્થાપના ના ૬૫ વર્ષ પુરા થઈ રહ્યા છે. તેમણે સંતોષ સાથે એવું પણ નોંધ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઊંડાણભર્યા અને વધુ મજબૂત બન્યા છે ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં.
4. ભારત અને મોંગોલિયાના રાજનૈતિક સંબંધોની સ્થાપના ના જ્યારે ૬૫ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે મોંગોલિયન ટપાલ ખાતા દ્વારા એક ખાસ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે. એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર દ્વારા મોંગોલિયન કાનજુર, બુદ્ધિસ્ટ કેનોનિકલ ટેકસ્ટ ૧૦૮-વોલ્યુમ તેના ૨૫ વોલ્યુમ કે જે ભારત સરકારે તેના નેશનલ મિશન ફોર મેનુસ્ક્રીપ્ટ હેઠળ છાપ્યા હતા તે વર્ચ્યુઅલી આપ્યા હતા.
5. બંને મિનિસ્ટર્સ દ્વારા પ્રાદેશિક અને બહુપક્ષીય ફોરમમાં બંને દેશો વચ્ચે કો-ઓર્ડિનેશનને હકારાત્મક રીતે મૂલ્યાંકન કર્યું હતું અને આ પરંપરા ચાલુ રાખવા માટે અને યોગ્ય આંતરરાષ્ટ્રીય ફોરમ પર એકબીજાને મદદ કરવા માટે પણ સંમત થયા હતા.
6. ભારતીય પક્ષ દ્વારા મોંગોલિયાના આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સમાં જોડાવાના નિર્ણય ને આવકારવામાં આવ્યો હતો. બંને પક્ષો એ બાબતે સંમત થયા હતા કે આ પગલું ભારત, મોંગોલિયા અને વિશ્વમાં કલીન એનર્જીના ઉપયોગ ને વધુ આગળ પ્રમોટ કરશે.
7. બંને પક્ષો વહેવામાં વહેલી તકે ગુલાલબટરમાં આયુષ ઇન્ફોર્મેશન સેલ સ્થાપિત કરવા માટે સંમત થયા હતા. મોંગોલિયા દ્વારા ભારતીય નાગરિકોને વિઝા ઓન એરાઈવલ દરજ્જો આપવા માટે તેની ભારતીય પક્ષ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
8. બંને મિનિસ્ટર્સ એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે કોવિડ-૧૯ મહામારીની ચેલેન્જ હોવા છતાં બંને દેશો વચ્ચે છેલ્લા થોડાક મહિનાઓ દરમિયાન ખાસ ફ્લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને કારણે બંને દેશોના નાગરિકો પોતાના દેશમાં પાછા જઈ શકે. બંને મિનિસ્ટર્સ દ્વારા કોવિડ-૧૯ ની મહામારી નો સામનો કરવા માટે શક્ય તેટલો સહકાર બાબતે કે જેમાં ભારતમાંથી કોવિડ-૧૯ ની રસી મંગોલિયા દ્વારા ભવિષ્ય માં મેળવવામાં આવે તે સહિત પોતાના દૃષ્ટિકોણ એકબીજા સાથે શેર કર્યા હતા.

9. મીટિંગ દરમિયાન બંને મિનિસ્ટર્સ દ્વારા હાલમાં ચાલી રહેલા ડેવલપમેન્ટલ પાર્ટનરશીપ પ્રોજેક્ટ ના પ્રોગ્રેસનું મૂલ્યાંકન કર્યું હતું કે જેમાં ૧.૨૩૬ યુ.એસ બિલિયન ડોલર નો લાઇન ઓફ ક્રેડીટ ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ અને 20 યુએસ મિલિયન ડોલર નો અટલબિહારી વાજપાઇ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આઇસીટી એન્ડ આઉટસોર્સિંગ નો સમાવેશ થાય છે.
10. ભારત મંગોલિયા સહકાર માટેની સંયુક્ત સમિતિ ની આગામી મીટીંગ ૨૦૨૧ ના વર્ષમાં યોજવા માટે બંને પક્ષો સંમત થયા હતા.

ન્યુ દિલ્હી
ડિસેમ્બર ૩, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.